

MEHTA INTEGRATED FINANCE LTD.

CIN NO : L65910GJ1985PLC007692

Date: 15/11/2022

To,
BSE Limited
Corporate Relationship Department
PJ Towers, Fort,
Dalal Street,
Mumbai - 400 001 .

Sub.:- Unaudited Financial Results for the quarter & half year ended 30.09.2022–Publication of Advertisement in News Papers

Scrip Code: 511377

Dear Sir/Madam,


In continuation of our outcome of Board Meeting and Unaudited Financial Results for the quarter ended on 30.09.2022 under regulation 33 of SEBI(LODR) Regulations, 2015 submitted to the Exchange on 11.11.2022, please find enclosed the copy of the Unaudited Financial Results advertisement published in English Edition (Free Press) an Regional Language (Gujarati Edition- Lok Mitra) for information and Record.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully,

For, Mehta Integrated Finance Limited



Kamleshbhai P. Patel
Company Secretary & Compliance Officer

Enclosure: A/a

EDITORIAL

Why WHO's alert over Indian medicines in Gambia should not be ignored

India's apex medical regulatory body, Central Drugs Standard Control Organisation (CDSCO), and state authorities have opened investigations into cough syrups manufactured by Maiden Pharmaceuticals after being alerted by the WHO. Sixty-six children have allegedly died in Gambia after consuming the medicines manufactured by the Haryana-based pharma company. The global health agency said that its laboratory analysis of samples of these syrups — Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup and Magrip N Cold Syrup — revealed the presence of "unacceptable amounts of diethylene glycol and ethylene glycol". These chemicals are toxic to humans, and can result in abdominal pain, diarrhoea, inability to pass urine, headache, and altered mental state. It can also lead to acute kidney injury that can prove fatal in children. In 2020, 17 children died in Jammu and Kashmir after consuming a syrup with high levels of diethylene glycol. After this tragedy, India phased out cough syrups in favour of suspensions that do not carry the risk of containing the two toxins. However, by all accounts, such dubious quality drugs continue to be manufactured, and they often find their way to Third World countries where regulations are weak. Preliminary inquiries have revealed that Maiden Pharmaceuticals manufactured the four cough syrups only for export to Gambia. That should be no reason for relaxing regulatory scrutiny on them in

Arvind Kejriwal's retort at Dehi L-G stands out in grim and humourous times

Descriptions of Indian politics rely on metaphors that are usually violent. There's "poaching of leaders", "battleground x" (where x is a state going to polls), and even the "cut and thrust of debate" in the legislature. As politics becomes more and more polarised, the political conversation is turning increasingly vitriolic. Parliament, the putative centre of debate and dissent, is either stifling disagreement and discussion or being held up by disruptions, depending on which side of the fence you stand. What is missing in all this — whether from the high-minded pulpit or the shrill attacks on TV channels — is a bit of humour. In such a party, Delhi Chief Minister Arvind Kejriwal's jibe at L-G V K Saxena is striking. It was uncharacteristically silent after an irate Saxena wrote to him

demanding an explanation for his absence at Raighat on Gandhi Jayanti. When he did finally respond via Twitter, Kejriwal asked the L-G to "chill", saying that "my wife doesn't sound me as much as the L-G sahib does every day". This light moment, the well-timed display of wit, is a breath of fresh air, not just because Kejriwal usually sounds heavy-footed and self-righteous as he paints contrived oppositions between "us", the AAP vs "them", the political class. More importantly, in these grim times, it is a rare instance of someone in high office wearing power lightly. Not so long ago, wit and the lighter moment weren't quite so rare. Parliament, in particular, was a place for poking gentle fun at L-G V K Saxena's striking. It was uncharacteristically silent after an irate Saxena wrote to him

from the high-minded pulpit or — is a bit of humour. In such a party, Delhi Chief Minister Arvind Kejriwal's jibe at L-G V K the shrill attacks on TV channels setting, Delhi Chief Minister Saxena is striking.

SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd, Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-83, WFI IT Park, Wagale Industrial Estate, Thane, Maharashtra-400064

Whereas the undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice (Rs.)	Name of Branch
1	Nidhi Sureshbhai Gohel & Mayur Kumar RANCHHOTBHAI KALARYA-LBRAJ00004285 & LBRAJ0000538204	Plot No. A 802, Gulabnagar, Kajivanj Road, Rajkot, Rs. No. 58.3P, 1, Gujarat, Rajkot-360002/ November 07, 2022	July 27, 2022 Rs. 11,83,184.00/-	Rajkot
2	Samikumar R Patel & Patel Hatbhar Samir Kumar LBBRH00002171623	Plot No. B/38, Mangal Darshan Society, Zadeshwar Road, Near Chhatra Mandir, R. S. No. 88/81+62+89, Bhuchar 392001/ November 07, 2022	July 29, 2022 Rs. 13,24,850.00/-	Bharuch
3	Vishakha Devi Mandl & Arvind Kishan Patil LBBRH00004150833	Plot No. 126, Ground Floor, "Green City" Near Green Park Society, Ghatiya-Ankleshwar, Jitali, Rs. No. 113 Pajki Gujarat Ankleshwar-393001/ November 07, 2022	April 11, 2022 Rs. 6,28,115,777.99	Bharuch
4	Mandali Arvind Kokali & Vishakha Devi LBBRH00005380402	Plot No. 126, Block No. 126, Green City, Near Green Park Soc, Rs. No. 113, Jitali, Gujarat, Ankleshwar, 393003/ November 07, 2022	April 25, 2022 Rs. 2,44,432.00/-	Bharuch
5	Gulabgar Gosai & Gulabvibhar Coowami-LBJAM00005099949 & LBJAM00005195820	Plot No. 23/3, Avadh Nagar Nri Girls Hostel Off Khambhalia Road, Lakhavav, S. No. 10, Paikil Village Gujarat, Jammgar 361001/ LBJAM00002679811	July 20, 2022 Rs. 20,24,212.00/-	Jam-nagar
6	Gulmahmad Abdullganj Sanji & Shahenz Gulmahmad Abdullganj Sanji-LBRAJ00002679811	Plot No. 136, Block No. 16 Sucty 2 N Rabbani Park, Morkanda Road Outside Kalwad Naka, Rajkot, Gujarat, Jammgar, 361001/ November 09, 2022	May 21, 2022 Rs. 4,74,037.00/-	Rajkot
7	Bhumil Y Shah & Yashv Sarda LBBAD00004423257	Plot No. B/3 (2nd) Floor, "Blossom Residency", Sitar Park, N. No. 300, Near Narsingpur 1 Mje-gate, P. No. 19, Shrome No. 09, 2022	May 30, 2022 Rs. 39,67,410.00/-	Ahmedabad

The above-mentioned borrowers (s) guarantors (s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date : November 11, 2022
Place : Rajkot

Authorized Officer
ICICI Bank Limited

MEHTA INTEGRATED FINANCE LIMITED
CIN: L65910G1985PLC007692

Reg. Off: 003, Law Garden Apartment, Scheme-1, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006
E-mail : mifl_in@yahoo.com. Website: www.mehtaintegratedfinance.com Ph: 079-26561000

Extract of Statement of Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2022, (Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended			Year ended
		30.09.2022 (Un-audited)	30.09.2021 (Un-audited)	31 March 2022 (Audited)	
1	Total Income	22.30	20.28	38.33	
2	Total Expenses	6.85	9.68	69.22	
3	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	15.44	10.60	-30.89	
4	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	15.44	10.60	-30.89	
5	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	15.44	10.60	-30.89	
6	Total comprehensive income for the period (after tax)	15.44	10.60	-30.89	
7	Paid up equity share capital	500	500	500	
8	Reserve (excluding revaluation reserve)	0	0	879.51	
9	Earning per share (for Rs. 10/-each) Basic and Diluted	0.31	0.21	-0.62	

Note: (1) The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2022 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (2) The full format of the same alongwith the note is available on the website of stock exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtaintegratedfinance.com

For, Mehta Integrated Finance Limited
Sd/-
Chirag D. Mehta
Whole-time Director
(DIN: 00484709)

MEHTA SECURITIES LIMITED
CIN: L67100G1994PLC02740

Reg. Off: 002, Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad - 380006
Website: www.mehtasecurities.com | Email ID: mehtasec@gmail.com
Ph: 079-26561000

Extract of Statement of Standalone Un-audited Financial Results for the quarter & half year ended 30th September, 2022, (Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended			Year ended
		30.09.2022 (Un-audited)	30.09.2021 (Un-audited)	31.03.2022 (Audited)	
1	Total Income	5.94	4.84	44.46	
2	Total Expenses	5.54	9.12	43.25	
3	Net profit / (loss) for the period (before exceptional items and/or Extraordinary Items)	0.40	-4.28	-87.71	
4	Net profit / (loss) for the period before tax (after exceptional items)	0.40	-4.28	-87.71	
5	Net profit / (loss) for the period after tax (after exceptional items)	0.40	-4.28	-87.71	
6	Total comprehensive income for the period (after tax)	0.40	-4.28	-87.71	
7	Paid up Equity Share Capital	308.94	308.94	308.94	
8	Reserve (excluding revaluation reserves as shown in the Audited Balance Sheet of Previous Year)	0	0	187.92	
9	Earning per share (for Rs. 10/-each) Basic and Diluted	0.01	-0.14	-2.84	

Note: (1) The above is an extract of the detailed format of Un-audited Financial Results for the quarter & half year ended 30th September, 2022 filed with Stock Exchange under regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (2) The full format of the same alongwith the note is available on the website of stock exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtasecurities.com

For, Mehta Securities Limited
Sd/-
Bhavna D. Mehta
Chairperson & Managing Director
(DIN: 01590958)

SAR AUTO PRODUCTS LIMITED
Regd. Office: 50-E BHAKTINAGAR INDUS ESTATE, RAJKOT 360 001
CIN: L34100G1987PLC00088
Website: www.sarautoproducts.com, Email: sar@sarautoproducts.com

Extract of Unaudited Financial Result for the quarter ended on 30th September, 2022. (Rs. in Lacs except per share data)

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended
		30-Sep-22 (Unaudited)	30-Sep-21 (Unaudited)	30-Sep-21 (Unaudited)	
1	Total Income from Operations (Less: Net Profit/Loss for the period before Tax, Exceptional and Extra Extra Ordinary Items)	35.00	22.89	20.00	65.16
2	Net Profit/Loss for the period before Tax after Exceptional and Extra Ordinary Items	35.00	22.89	20.00	65.16
3	Net Profit/Loss for the period after Tax (after Exceptional and Extra Ordinary Items)	35.00	22.89	20.00	65.16
4	Total Comprehensive Income for the period (after tax)	35.00	22.89	20.00	65.16
5	Equity Share Capital (Rs. 10/- each)	100.00	100.00	100.00	100.00
6	Reserve (including Revaluation Reserves)	0.00	0.00	0.00	0.00
7	Earnings per Share (EPS) (Rs. 10/- each) (continued operations)	0.35	0.23	0.20	0.65
8	Basic	0.35	0.23	0.20	0.65
9	Diluted	0.35	0.23	0.20	0.65

Note: a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges and the listed entity. b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. c) = Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS (AS) Rules, whichever is applicable.

For and on behalf of Board of Director,
Ramesh D. Virani
Chairman & Managing Director
DIN : 00313236

FULLERTON INDIA HOME FINANCE COMPANY LIMITED
CIN: L65910G1985PLC007692

Regd. Off: Megh Towers, Floor 3, Old No. 165, Poonamallee High Road, Madhavurayal, Chennai - 600095

WHEREAS the undersigned being the Authorized Officer of Fullerton India Home Finance Company Limited a Housing Finance Company (duly registered with National Housing Bank (Fully Owned by RBI)) (hereinafter referred to as "FHFC") having its registered office at Megh Towers, Floor 3, Old No. 165, Poonamallee High Road, Madhavurayal, Chennai, Tamilnadu - 600095 under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SAR) and in exercise of the powers conferred under Section 13(1) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrowers mentioned herein below having failed to repay the amount, notice is hereby given to the borrowers mentioned herein below and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under sub-section (4) of section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002. The borrowers mentioned here in and in particular and the public in general are hereby cautioned not to deal with said property and any dealings with the property will be subject to the charge of Fullerton India Home Finance Company Limited for an amount as mentioned herein under and interest thereon.

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s) Loan Account No.	Description of Secured Assets (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Symbolic Possession
01	LAN: 600507210235175 (1) ASHWINI KAPUR & ASHWINI KAPUR (2) SHILPA ASHWINI KAPUR Add. 1: PLOT 309, SWAMI NARAYAN NAGAR, SATAPPA ROAD ANAR, ANAR, RAJKOT, RAJKOT, ANAR, ANAR, GUJARAT - 370110, EMAIL: ASHWINKAPUR@GMAIL.COM, Add. 2: HOUSE PROPERTY TO BE CONSTRUCTED UPON A LAND FOR RESIDENTIAL USE BEARING PLOT NO. 309 (PART NORTH SIDE) & 8/2 (PART SOUTH SIDE) - 83-84 SQ. METRS, SHRI SWAMINARAYAN NAGAR, SITUATED AT VILLAGE RATA TARAV ANAR DIST. KACHCHI IN SUB REGISTRATION DIST. ANJAR GUJARAT. BOUNDARIES: NORTH: PLOT NO. 310, SOUTH: PLOT NO. 308, EAST: PLOT NO. 342, WEST: ROAD.	ALL THAT PIECE AND PARCEL OF THE HOUSE BEARING PLOT NO. 309 (PART NORTH SIDE) UPON A LAND FOR RESIDENTIAL USE BEARING PLOT NO. 309 (PART NORTH SIDE) & 8/2 (PART SOUTH SIDE) - 83-84 SQ. METRS, SHRI SWAMINARAYAN NAGAR, SITUATED AT VILLAGE RATA TARAV ANAR DIST. KACHCHI IN SUB REGISTRATION DIST. ANJAR GUJARAT. BOUNDARIES: NORTH: PLOT NO. 310, SOUTH: PLOT NO. 308, EAST: PLOT NO. 342, WEST: ROAD.	Date: 21.03.2022 Rs. 2,29,230.00/- (Rupees Seven Lakhs) Eighty Seven Thousand Seven Hundred Twenty three and paise thirty only and interest other charges thereon	09.11.2022 (Symbolic Possession)
02	LAN: 600507210608440 (1) RANJAN RANIKANT ORYA (2) RINAMANI SADRANANDA HASODA Add. 1: BESIDE, HAROM APARTMENT, RAIPUR MORA, JUNU GAN HAR TOWER N/81, MAHIM, GUJARAT - 363661. Add. 2: PLOT NO. 81 (PART NORTH SIDE) & 8/2 (PART SOUTH SIDE), DHARTI PARK SOCIETY, B/H BARAJANG SOCIETY, VANDRO ROAD, MORBI - 363611.	IMMOVABLE PROPERTY OF OPEN LAND MEASURED 47.12 SQ. MT NORTH SIDE OF OPEN PLOT NO. 81 (P) SOUTH SIDE OF PLOT NO. 82 (P) IN AREA CALLED "DHARTI PARK" SITUATED AT MADHAPAR, R.S. NO. 282, TAL. DIST. MORBI, BOUNDARIES: NORTH : OTHER LAND OF PLOT NO. 81 (P), SOUTH: OTHER LAND OF PLOT NO. 81 (P), EAST: LAND OF SURVEY NO. 286, WEST : 7.50 MT ROAD.	Date: 21.07.2022 Rs. 6,16,507.49 (Rupees Six Lakhs) Fifty Five Thousand Five Hundred Ninety one only and interest other charges thereon	10.11.2022 (Symbolic Possession)
03	LAN: 600507210625850 (1) SADANANDA HASODA, S/O RANIKANT ORYA (2) RINAMANI SADRANANDA HASODA Add. 1: ROOM NO. 50 A BLOCK LONG NAGAR, NR VAGAD HOSPITAL, BHACHAU - 370140. Add. 2: SUB SURVEY NO. 308 & 308.1, R/S NO. 246/1, P. No. 25/27/7/1, BAGESHWAR 3, AT VARSAMEDI TAL ANAR KATCH - 370110.	ALL THAT PIECE AND PARCEL OF THE PROPERTY BEARING A LAND FOR RESIDENTIAL PURPOSE BEARING SUB PLOT NO. 50A ADESKURING ABOUT 45.50 SQ. METRS, MAIN PLOT NO. 30, REVENUE SURVEY NO.246/1/1, P. No. 25/27/7/1, BAGESHWAR 3, AT VARSAMEDI TAL ANAR KATCH - 370110.	Date: 09.02.2022 Rs. 6,16,507.49 (Rupees Six Lakhs) Fifty Five Thousand Five Hundred Seven and Paise Forty Three only and interest on 09.02.2022	09.11.2022 (Symbolic Possession)

Date: 12.11.2022
Place: Gujarat

Authorized Officer
FULLERTON INDIA HOME FINANCE COMPANY LIMITED

PARKER AGROCHEM EXPORTS LIMITED
(CIN: L24110G1993PLC021012)

Registered Office: Block H, Plot 3 & 4, New Kandla - 370 2710 (Kutch)
Corporate office: 401, 4th Floor, Turquoise Building, Panchwati Five Roads, Ahmedabad-380006 (Gujarat)

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2022

Particulars	(Rs. in Lacs)		
	Quarter ended 30-09-2022 (Unaudited)	Cumulative upto 30-09-2022 (Unaudited)	Quarter ended on 30-09-2021 (Unaudited)
Total Income from operations	104.91	199.44	85.70
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	21.48	15.14	(23.77)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items #)	21.48	15.14	(23.77)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items #)	21.48	15.14	(23.77)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)	21.48	15.14	(23.77)
Equity Share Capital	477.90	477.90	477.90
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	0.45	0.32	(0.50)
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	0.45	0.32	(0.50)

Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. 2. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com). 3. # = Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

By Order of the Board,
For PARKER AGROCHEM EXPORTS LIMITED
Sd/-
JAGDISH R. ACHARYA (DIN NO. 01251240)
CHAIRPERSON & MANAGING DIRECTOR

BEFORE THE RECOVERY OFFICER, GOVERNMENT OF INDIA
MINISTRY OF FINANCE, DEPARTMENT OF FINANCIAL SERVICES
DEBTS RECOVERY TRIBUNAL (DRT) - Ahmedabad
2ND FLOOR, TELEPHONE BHAVAN, COLABA, MUMBAI-400 005

RECOVERY PROCEEDING NO. 123 OF 2021
TRANSFER ORIGINAL APPLICATION NO. 1448 OF 2016
NOTICE FOR SETTLING THE SALE PROCLAMATION
Exh. No. 20 Date: 30.09.2022
ICICI Bank Limited Applicant/Certificate Holder
Carona Limited & Ors. Versus Defendants/Certificate Debtors To Carona Limited, (Certificate Debtor No. 1)
New Kidney Mandir Compound, Mogalwadi (West), Bombay 400 016.
Whereas the Hon'ble Presiding Officer, Debts Recovery Tribunal, Mumbai has issued Recovery Order No. 123 of 2021 against you, Carona Limited, (Certificate Debtor No. 1) to pay the sum of Rs. 60,40,724/- (Rupees Six Crores Ninety Lakhs Four Thousand Seven Hundred Twenty Four Only) and interest and due to the undersigned, the undersigned has attached these immovable properties as more particularly described in the Schedule hereunder written and annexed to this notice.
You are hereby informed that the 30th day of November, 2022 has been fixed for drawing up the proclamation of the sale and settling the terms thereof. You are hereby called upon to participate in the settlement of the terms of the proclamation and to bring to the notice of undersigned any encumbrances, charges, claims or liabilities attached to the said immovable properties or any portion thereof.

SCHEDULE:
Particulars of Immovable Property at Gujarat : All that piece or parcel of non-agricultural freehold land in all adjoining measuring 2255.711 sq. yds. equivalent to 1880 sq. mtrs. more or less, situated at Plot Land known as Private Plot No. 4 measuring 2047.6019 sq. yds. Equivalent to 1712 sq. mtrs. and Road Land measuring 208.10907 sq. yds. Equivalent to 174 sq. mtrs. Representing one (1) share in the said Private Plot No. 4 and in the Private Road Land- both forming part of Consolidated Survey No. 808 of Mouje Indrad of Kadl Taluka in District of Gujarat. The said Private Plot No. 4 is bounded as follows, i.e., to, on or towards the East by: Internal Road in Survey No. 808
to or towards the West by: Nal Road
to or towards the North by: Private Plot No. 3 in Survey No. 808
to or towards the South by: Nal Road
Given under my hand and seal of the Tribunal on this 13 day of October, 2022. (Ajay Tripathi) Recovery Officer

Form No. INC-36
[Pursuant to rule 30 of the Companies (Incorporation) Rules, 2014]
Before the Central Government, Regional Director
North Western Region, Ahmedabad

In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014
AND
In the matter of Localwell Healthcare Private Limited (CIN: U72900G2019PT110167)
having its registered office at B-401, Lake View Tower, Opp. Vastrapur Lake, Near Aifa Mall, Vastrapur Ahmedabad, Gujarat-380015, India
.....Applicant Company/Petitioner
NOTICE is hereby given to the General Public that the Company proposes to make application to the Central Government under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extraordinary general meeting held on Wednesday, the 26th Day of October, 2022 to enable the Company to change its Registered Office from "State of Gujarat" to "State of Karnataka". Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the Company may deliver either on the MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post with his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director, North Western Region having office at Roc Bhavnagar, Opp. Ruppal Park Society, Behind Ankur Bus Stop, Naranpura, Ahmedabad-380013, Gujarat within 14 (Fourteen) days of the date of publication of this notice with a copy to the applicant Company at the address mentioned below:
B-401, Lake View Tower, Opp. Vastrapur Lake, Near Aifa Mall, Vastrapur Ahmedabad, Gujarat-380015, India.

For and on behalf of the Localwell Healthcare Private Limited
Sd/-
Chirag Agrawal
Director
DIN: 08579590
Date: 12.11.2022
Place: Ahmedabad

For and on behalf of Board of Director,
Ramesh D. Virani
Chairman & Managing Director
DIN : 00313236
Place: Rajkot
Date: November 11, 2022

